



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૪/૦૭/૨૦૧૯ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૨૩૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૬૦ કેસ કરી, ૪૭ વ્યક્તિઓને ઝડપી, ૧૩૫ લીટર દેશી દારૂ, ૧૮૦ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૧ મોટર સાયકલ કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી, ૨૧ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧,૪૩,૬૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૨૩૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૧૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૨ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૨૪૦/૧૯

એલીસબ્રીજ: લવકુમાર ઋષભભાઈ જૈન (ઉ.વ.૨૬) (રહે. ગોલ્ડન તુલીપ બંગ્લોઝ માણેકબાગ હોલ પાછળ શ્રેયસ ફાઉન્ડેશનની બાજુમાં આંબાવાડી) એ તા.૨૩/૦૭/૧૯ નારોજ એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા. ૨૮/૦૪/૨૦૧૬ થી આજદિન સુધીના સમયગાળા દરમિયાન રત્નમણી ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. કંપનીના રજીસ્ટર લેન્ડ લાઈન ટેલીફોન નંબર ઉપર તેમજ લવકુમારના મોબાઈલ નંબર ઉપર વિરેશ કિર્તિ ગણાત્રા (રહે. વિશ્વાનગર સોસાયટી મણિનગર) એ ફોન કરી પોતાને ડામરની મોટી માત્રામાં આગળ માલ મોકલવાનો હોય લવકુમાર પાસેથી ડામર ખરીદ કરવા લવકુમારની રત્નમણી ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. કંપની માંથી ડામરનો માલ ઓર્ડર કરી રૂપિયા ડામર માલ કિંમત રૂપિયા ૪૫,૩૪,૯૦૪/- મેળવી લઈ માલ સેન્ટ સોલ્ઝર કંપની છાણી જમ્મુ ખાતે મોકલી આપી કંપની સાથે સાંઠ-ગાંઠ કરી ડામરના માલના નાણા બારોબાર પર્લ કોલટેક કંપનીના ખાતામાં મેળવી લઈ લવકુમાર સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.પી.જેબલીયા ચલાવે છે.

સરખેજ: રામ નિરંજન જગદીશ સૈની (ઉ.વ.૪૦) (રહે. વોર્ડ નં-૨૯ રાણીસતી મંદિર પાસે, લક્ષ્મણગઢ, જિલ્લા-સિકર, રાજસ્થાન) એ તા.૨૩/૦૭/૧૯ નારોજ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે આરોપી (૧) સુમીત નારંગ અને (૨) બંસીભાઈ (બન્નેના પુરા નામ સરનામાની ખબર નથી) એ તા.૨૨/૦૭/૨૦૧૯ બપોરના ૩/૩૦ વાગ્યાના સુમારે ૧૦% ના ભાવે ગોલ્ડ સસ્તુ આપવાનું કહી મને ગોલ્ડ ખરીદવાના બહાને સરખેજ સરદાર પટેલ રીંગ રોડ મહંમદપુરા ખાતે રામ નિરંજન જગદીશ સૈનીને બોલાવી રૂપિયા ૫૪,૦૦,૦૦૦/- લઈ ગોલ્ડ નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.ડી.યુડાસમા ચલાવે છે.

નારણપુરા: દિનેશભાઈ સ/ઓ માધવાલાલ પટેલ (રહે. અક્ષર જ્યોત એપાર્ટમેન્ટ રામદેવનગર ચાર રસ્તા સેટેલાઈટ) એ તા.૨૩/૦૭/૧૯ નારોજ નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૧/૦૭/૨૦૧૮ થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન આરોપી (૧) ભરતકુમાર રણજીતસિંગ પુરોહિત (૨) વિક્રમસિંગ રણજીતસિંગ પુરોહિત (૩) રીતેશસિંગ રણજીતસિંગ પુરોહિત (તમામ રહે. અમર એપાર્ટમેન્ટ ટેલિફોન એક્સચેંજ સામે નારણપુરા) એ ભેગા મળી નારણપુરા સ્વામિનારાયણ એવન્યુ દુકાન નં.૧૧ ૮૬,૦૦,૦૦૦/- નક્કી કરી દિનેશભાઈને વેચાણ આપતા દિનેશભાઈએ નાણાની ભરપાઈ કરી દીધેલ હોવા છતાં આજદિન સુધી દસ્તાવેજ નહીં કરી આપી કે નાણા પરત નહીં આપી દિનેશભાઈ પટેલ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.આર.ગામીત ચલાવે છે.

ધરફોડ:-

સમાચાર યાદી નં.૧૨૪૧/૧૯

રાણીપ: દેવાંગભાઈ બાબુભાઈ મેવાડા (રહે. ચાણસ્મા સોસાયટી બલોલનગર ચાર રસ્તા પાસે રાણીપ) એ રાણીપ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૨/૦૭/૧૯ બપોરના ૧/૩૦ વાગ્યાના સુમારે પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૫૮,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી ભાવિનભાઈ મનસુખભાઈ ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૧૨૪૨/૧૯

ઘાટલોડીયા: કમલેશભાઈ સ/ઓ જગદીશચંદ્ર રાવલ (ઉ.વ.૫૮) (રહે. એફ/૨૫૩ ન્યુ નોર્થ કોલોની અંબુજાનગર વેરાવળ-કોડીનાર રોડ તા-કોડીનાર જીલ્લો-ગીર સોમનાથ) એ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૮/૦૭/૧૯ રાતના ૮/૦૦ વાગ્યાના સુમારે કોડીનારથી તા.૧૯/૭/૧૯ સવારના ૫/૪૫ વાગ્યાના સુમારે અમદાવાદ ઘાટલોડીયા મેમનગર આવ્યા દરમ્યાન અજાણી વ્યક્તિએ થેલામાંથી સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૬,૧૦,૫૦૦/- મતાની ચોરી કરી લીધી હતી. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.આર.ગામીત ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૨૪૩/૧૯

શાહીબાગ: કોમલબહેન લક્ષ્મણભાઈ શાહ (રહે.શાંતિપુરા મનુભાઈની જુની ચાલી ગીરધરનગર શાહીબાગ) અગમ્ય કારણસર તા.૨૩/૭/૧૯ સવારના ૮/૦૦ થી બપોરના ૧/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે શાહીબાગ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી ઇશ્વરભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.